



सत्यमेव जयते

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXIII]

TUESDAY, 18th OCTOBER, 2022/ASHVINA 26, 1944

[No. 86

Separate paging is given to each part of the supplement to the Central Gazette and Central section in order that it may be filed as a separate compilation

PART-II

EXTRAORDINARY

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૮ (ઉમરવાડા) અંતિમમાં ફા.પ્લોટ નં. ૧૩ “ઓપન સ્પેસ”નો હેતુ ફેર કરી “પબ્લીક યુટીલીટી”નો જાહેર હેતુ કરવા વેરીએશન કરવા અંગેનો સુધારાનો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત.

અધિસૂચન

નં. ટીપીડી/આ/૩૧૧૭.—આથી જાહેર કરવામાં આવે છે કે, ઉપરોક્ત સુધારાનો મુસદ્દો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ ૭૨(ક) અને અધિનિયમના નિયમ ૩૬ અન્વયે તૈયાર કરવામાં આવેલ છે અને પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

ઉપર જણાવેલ સુધારાના મુસદ્દાની એક નકલ હિતસંબંધ ધરાવનારા વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રી, ટાઉન પ્લાનીંગ વિભાગ, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતની કચેરીમાં રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લો રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચન પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર સુધારાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ, આ સુધારાના સંબંધમાં વાંધા / સૂચનો લેખિત રીતે કમિશનર, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, કમિશનર, સુરત મહાનગરપાલિકા આવા વાંધાઓ યોગ્ય જણાયે ધ્યાનમાં લેશે.

સુરત

તા. ૧૫-૧૦-૨૦૨૨

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા.૧૫-૧૦-૨૦૨૨ના રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો.

મ્યુ.કમિશનરશ્રીના તા.૩૦-૦૮-૨૦૨૨ના પત્ર નં.સીમીસ/૮/૧૪ થી વિદીત થઈ, ફાઈલના પત્ર વ્ય.વિ. પાના નં.૧૦૩ થી ૧૦૫ પર સામેલ નકશા તથા રીડીસ્ટ્રીબ્યુશન સ્ટેટમેન્ટમાં દર્શાવ્યા મુજબ ફાયનલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૮(ઉમરવાડા)માં એપ્રોપ્રીએટ ઓથોરીટી સુરત મહાનગરપાલિકાને ફાળવેલ ફા.પ્લોટ નં.૧૩ (ક્ષેત્રફળ ૭૧૮ ચો.મી.), “ઓપન સ્પેસ”નો હેતુ ફેર કરી “પબ્લીક યુટીલીટી”નો જાહેર હેતુ કરવા ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ-૭૦(એ) અને ૭૨ની જોગવાઈઓ હેઠળ વેરીએશન કરવાનું તથા આ અંગે આ સાથે સામેલ અધિસૂચન મંજૂર કરવાનું અને આ અંગે આગળની તમામ આનુસંગિક કાર્યવાહી કરવા મ્યુ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૫/૨૦૨૨ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા**મોજે : વરીયાવ વિસ્તારની નગર રચના યોજના સુરત નં. ૮૮(વરીયાવ) તૈયાર કરવા બાબત.****અધિસુચન**

નં. ટીપીડી/૩૧૧૮.-ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ (પ્રેસીડન્ટ એક્ટ નં.૨૭)ની કલમ-૪૧ ની જોગવાઈઓ હેઠળ સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિનાં ઠરાવ નં.૧૮/૨૦૨૨, તા. ૧૫-૧૦-૨૦૨૨ થી ઠરાવ્યા મુજબ, સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૮(વરીયાવ)ની દરખાસ્તને અધિનિયમની કલમ-૪૧ (૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યને તા. ૨૭-૦૭-૨૦૨૨ થી આપેલ પરામર્શ અન્વયે નકશા નં.ટીપીએસ/૮૮માં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવ્યા મુજબ મોજે : વરીયાવ વિસ્તારમાં નગર રચના યોજના સુરત ૮૮ (વરીયાવ) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવામાં આવે છે. જે મુજબના નકશાની એક નકલ, જમીન માલિકો તેમજ હીત સંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરત ખાતે રજાના દિવસો સિવાયનાં દિવસે ઓફિસ સમયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

સુરત

તા. ૧૫-૧૦-૨૦૨૨

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

ઠરાવ

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા.૧૫-૧૦-૨૦૨૨નાં રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો

મ્યુ. કમિશનરશ્રીનાં તા. ૨૬-૦૮-૨૦૨૨નાં પત્ર નં. સીમીસ/૮/૮ થી વિદિત થઈ, સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ સુચિત નગર રચના યોજના, સુરત નં. ૮૮(વરીયાવ)ને મુખ્ય નગર નિયોજકશ્રી, ગાંધીનગરના પત્ર નં. નરયો નં. ૮૮(વરીયાવ)/કલમ ૪૧(૧)/હદ પરામર્શ/૨૮૮૨, તા.૨૭/૦૭/૨૦૨૨ થી અધિનિયમની કલમ-૪૧ (૧) હેઠળ આપેલ પરામર્શ અન્વયે સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૮ (વરીયાવ) તૈયાર કરવા અંગે દરખાસ્ત સાથે સામેલ નકશામાં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવેલ વિસ્તારમાં નગર રચના યોજના સુરત ૮૮ (વરીયાવ) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવાનું, ઈરાદો જાહેર કરવા અંગે સામેલ અધિસુચન મંજૂર કરવાનું તથા સદર અધિસુચન બહોળો ફેલાવો ધરાવતા બે સ્થાનિક ટ્રેનિકપત્રોમાં એક - એક વખત પ્રસિધ્ધ કરવાનું તથા ઈરાદો જાહેર કર્યા મુજબ તેને સરકારશ્રીનાં રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવા તેમજ મુસદ્દો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૧૮/૨૦૨૨ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા**નગર રચના યોજના, સુરત નં. ૦૮ (પાલનપોર) (પ્રથમ ફેરફાર)નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત****અધિસુચન**

નં. ટીપીડી/આ/૩૧૧૮.-આથી જાહેર કરવામાં આવે છે કે, મુસદ્દારૂપ નગર રચના યોજના, સુરત નં.૮(પાલનપોર) (પ્રથમ ફેરફાર)નો મુસદ્દો, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમના નિયમો-૧૯૭૮ના નિયમ-૧૮ હેઠળ (યોજનાના મુસદ્દાની દરખાસ્ત) તૈયાર કરેલ છે. જેને આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

અંતિમ ટી.પી.સ્કીમ નં.૮(પાલનપોર)માં બ્લોક નં. ૮૪, ફા.પ્લોટ નં.૮૮/૧ માં સ્થિત તપસ નગર સોસાયટીના પ્લોટ નં.૭૧ થી ૭૭ વાળી જમીન પુરતુ રીઝર્વેશન રદ કરી બાકીની જમીન ઓપન સ્પેસના જાહેર હેતુ માટે રીઝર્વેશન નિયત કરવા માટે વેરીએશન કરવાની જરૂરીયાત હોય, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ની જોગવાઈઓ હેઠળ વેરીએશન કરવા અંગે ઉક્ત જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રી કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગના નોટીસ બોર્ડ પર, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરતમાં રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસુચન પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજના સંબંધમાં વાંધા/સુચનો બે નકલોમાં લેખિતમાં કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, આવા વાંધાઓ ધ્યાને લેવામાં આવશે.

સુરત

તા. ૧૫-૧૦-૨૦૨૨

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિના તા.૧૫-૧૦-૨૦૨૨ ના રોજ
મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો.

મ્યુ. કમિશનરશ્રીના તા. ૨૬-૦૮-૨૦૨૨ ના પત્ર નં. સીમીસ/૮/૧૭ થી વિદિત થઈ, અંતિમ ટી.પી.સ્કીમ નં.૮ (પાલનપોર)માં ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૭૧ મુજબ વેરીએશન કરવા સુચિત મુસદ્દારૂપ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૮(પાલનપોર) (પ્રથમ ફેરફાર) નો ઉક્ત કાયદાની કલમ-૪૨(૧) મુજબ મુસદ્દો પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી કરવાનું તથા દરખાસ્ત સાથે સામેલ અધિસુચન મંજૂર કરવાનું તથા તેને આનુસંગિક જરૂરી તમામ કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૮/૨૦૨૨ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા

મોજે : ગભેણી વિસ્તારની નગર રચના યોજના સુરત નં. ૮૭ (ગભેણી) તૈયાર કરવા બાબત.

અધિસુચન

નં. ટીપીડી/૩૧૨૦.—ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ (પ્રેસીડન્ટ એક્ટ નં.૨૭)ની કલમ-૪૧ ની જોગવાઈઓ હેઠળ સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિનાં ઠરાવ નં.૧૮/૨૦૨૨, તા. ૧૫-૧૦-૨૦૨૨ થી ઠરાવ્યા મુજબ, સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૭ (ગભેણી) ને અધિનિયમની કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યએ તા.૨૭/૦૭/૨૦૨૨થી આપેલ પરામર્શ અન્વયે નકશા નં.ટીપીએસ/૮૭માં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવ્યા મુજબ મોજે : ગભેણી વિસ્તારમાં નગર રચના યોજના સુરત ૮૭ (ગભેણી) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવામાં આવે છે. જે મુજબના નકશાની એક નકલ, જમીન માલિકો તેમજ હીત સંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરત ખાતે રજાના દિવસો સિવાયનાં દિવસે ઓફિસ સમયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

સુરત

તા. ૧૫-૧૦-૨૦૨૨

સહી/- અવારય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

ઠરાવ

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા.૧૫-૧૦-૨૦૨૨નાં રોજ
મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો

મ્યુ. કમિશનરશ્રીનાં તા. ૨૬-૦૮-૨૦૨૨ નાં પત્ર નં.સીમીસ/૮/૮ થી વિદિત થઈ, સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ સુચિત નગર રચના યોજના, સુરત નં. ૮૭ (ગભેણી) ને મુખ્ય નગર નિયોજકશ્રી, ગાંધીનગરના પત્ર નં. દ.ગુ./એસ.એમ.સી./૪૧(૧)/નરયો નં. ૮૭ (ગભેણી)/૨૮૮૨, તા. ૨૭-૦૭-૨૦૨૨ થી અધિનિયમની કલમ-૪૧ (૧) હેઠળ આપેલ પરામર્શ અન્વયે સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૭ (ગભેણી) તૈયાર કરવા અંગે દરખાસ્ત સાથે સામેલ નકશામાં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવેલ વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૮૭ (ગભેણી) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવાનું, ઈરાદો જાહેર કરવા અંગે સામેલ અધિસુચન મંજૂર કરવાનું તથા સદર અધિસુચન બહોળો ફેલાવો ધરાવતા બે સ્થાનિક દૈનિકપત્રોમાં એક-એક વખત પ્રસિધ્ધ કરવાનું તથા ઈરાદો જાહેર કર્યા મુજબ તેને સરકારશ્રીનાં રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવા તેમજ મુસદ્દો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૧૮/૨૦૨૨ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા

મોજે : વેસુ વિસ્તારની નગર રચના યોજના સુરત નં. ૮૧ (વેસુ) તૈયાર કરવા બાબત.

અધિસુચન

નં. ટીપીડી/૩૧૨૧.—ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ (પ્રેસીડન્ટ એક્ટ નં.૨૭)ની કલમ-૪૧ ની જોગવાઈઓ હેઠળ સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિનાં ઠરાવ નં.૨૧/૨૦૨૨, તા. ૧૫-૧૦-૨૦૨૨ થી ઠરાવ્યા મુજબ, સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૧ (વેસુ) ને અધિનિયમની કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યએ તા. ૨૭-૦૭-૨૦૨૨થી આપેલ પરામર્શ અન્વયે નકશા નં.ટીપીએસ/૮૧માં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવ્યા મુજબ મોજે : વેસુ વિસ્તારમાં નગર રચના યોજના સુરત

નં. ૯૧ (વેસુ) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવામાં આવે છે. જે મુજબના નકશાની એક નકલ, જમીન માલિકો તેમજ હીત સંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરત ખાતે રજાના દિવસો સિવાયનાં દિવસે ઓફિસ સમયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

સુરત

તા. ૧૫-૧૦-૨૦૨૨

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

ઠરાવ

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા.૧૫-૧૦-૨૦૨૨નાં રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો

મ્યુ. કમિશનરશ્રીનાં તા. ૨૬-૦૮-૨૦૨૨ નાં પત્ર નં.સીમીસ/૮/૧૧થી વિદિત થઈ, સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ સુચિત નગર રચના યોજના, સુરત નં.૯૧(વેસુ) ને મુખ્ય નગર નિયોજકશ્રી, ગાંધીનગરના પત્ર નં. નરયો નં. ૯૧(વેસુ)/કલમ ૪૧(૧)/૬૬ પરામર્શ/૨૯૮૩, તા. ૨૭-૦૭-૨૦૨૨ થી અધિનિયમની કલમ-૪૧ (૧) હેઠળ આપેલ પરામર્શ અન્વયે સુચિત નગર રચના યોજના સુરત નં. ૯૧ (વેસુ) તૈયાર કરવા અંગે દરખાસ્ત સાથે સામેલ નકશામાં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવેલ વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૯૧ (વેસુ) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવાનું, ઈરાદો જાહેર કરવા અંગે સામેલ અધિસુચન મંજૂર કરવાનું તથા સદર અધિસુચન બહોળો ફેલાવો ધરાવતા બે સ્થાનિક દૈનિકપત્રોમાં એક-એક વખત પ્રસિધ્ધ કરવાનું તથા ઈરાદો જાહેર કર્યા મુજબ તેને સરકારશ્રીનાં રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવા તેમજ મુસદ્દો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૧/૨૦૨૨ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા

મોજે : વેસુ વિસ્તારની નગર રચના યોજના સુરત નં. ૯૦ (સરસાણા) તૈયાર કરવા બાબત.

અધિસુચન

નં. ટીપીડી/૩૧૨૨.-ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ (પ્રેસીડન્ટ એક્ટ નં.૨૭)ની કલમ-૪૧ ની જોગવાઈઓ હેઠળ સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિનાં ઠરાવ નં.૨૨/૨૦૨૨, તા. ૧૫-૧૦-૨૦૨૨ થી ઠરાવ્યા મુજબ, સુચિત નગર રચના યોજના સુરત નં. ૯૦ (સરસાણા)ને અધિનિયમની કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યએ તા. ૨૬-૦૭-૨૦૨૨થી આપેલ પરામર્શ અન્વયે નકશા નં.ટીપીએસ/૯૦માં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવ્યા મુજબ મોજે : સરસાણા વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૯૦ (સરસાણા) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવામાં આવે છે. જે મુજબના નકશાની એક નકલ, જમીન માલિકો તેમજ હીત સંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરત ખાતે રજાના દિવસો સિવાયનાં દિવસે ઓફિસ સમયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

સુરત

તા. ૧૫-૧૦-૨૦૨૨

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

ઠરાવ

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા.૧૫/૧૦/૨૦૨૨નાં રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો

મ્યુ. કમિશનરશ્રીનાં તા. ૨૬-૦૮-૨૦૨૨ નાં પત્ર નં.સીમીસ/૮/૧૨થી વિદિત થઈ, સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ સુચિત નગર રચના યોજના, સુરત નં. ૯૦ (સરસાણા) ને મુખ્ય નગર નિયોજકશ્રી, ગાંધીનગરના પત્ર નં. નરયો નં. ૯૦ (સરસાણા)/કલમ ૪૧(૧)/૬૬ પરામર્શ/૨૯૫૮, તા.૨૬/૦૭/૨૦૨૨ થી અધિનિયમની કલમ-૪૧ (૧) હેઠળ આપેલ પરામર્શ અન્વયે સુચિત નગર રચના યોજના સુરત નં.

૯૦ (સરસાણા) તૈયાર કરવા અંગે દરખાસ્ત સાથે સામેલ નકશામાં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવેલ વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૯૦ (સરસાણા) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવાનું, ઈરાદો જાહેર કરવા અંગે સામેલ અધિસુચન મંજૂર કરવાનું તથા સદર અધિસુચન બહોળો ફેલાવો ધરાવતા બે સ્થાનિક દૈનિકપત્રોમાં એક-એક વખત પ્રસિધ્ધ કરવાનું તથા ઈરાદો જાહેર કર્યા મુજબ તેને સરકારશ્રીનાં રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવા તેમજ મુસદ્દો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૨/૨૦૨૨ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા

મોજે : કોસાડ વિસ્તારની નગર રચના યોજના સુરત નં. ૮૬ (કોસાડ) તૈયાર કરવા બાબત.

અધિસુચન

નં. ટીપીડી/૩૧૨૩.-ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ (પ્રેસીડન્ટ એક્ટ નં.૨૭)ની કલમ-૪૧ ની જોગવાઈઓ હેઠળ સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિનાં ઠરાવ નં.૨૦/૨૦૨૨, તા. ૧૫-૧૦-૨૦૨૨ થી ઠરાવ્યા મુજબ, સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૬ (કોસાડ)ને અધિનિયમની કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યએ તા. ૨૭-૦૭-૨૦૨૨થી આપેલ પરામર્શ અન્વયે નકશા નં. ટીપીએસ/૮૬ માં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવ્યા મુજબ મોજે : કોસાડ વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૮૬ (કોસાડ) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવામાં આવે છે. જે મુજબના નકશાની એક નકલ, જમીન માલિકો તેમજ હીત સંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરત ખાતે રજાના દિવસો સિવાયનાં દિવસે ઓફિસ સમયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

સુરત

તા. ૧૫-૧૦-૨૦૨૨

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

ઠરાવ

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા.૧૫-૧૦-૨૦૨૨નાં રોજ
મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો

મ્યુ. કમિશનરશ્રીનાં તા. ૨૬-૦૮-૨૦૨૨ નાં પત્ર નં.સીમીસ/૮/૧૦થી વિદિત થઈ, સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ સુચિત નગર રચના યોજના, સુરત નં. ૮૬ (કોસાડ) ને મુખ્ય નગર નિયોજકશ્રી, ગાંધીનગરના પત્ર નં.દ.ગુ./એસ.એમ.સી./૪૧(૧) / નરયો નં. ૮૬ (કોસાડ)/ ૨૮૮૧, તા. ૨૭-૦૭-૨૦૨૨ થી અધિનિયમની કલમ-૪૧ (૧) હેઠળ આપેલ પરામર્શ અન્વયે સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૬ (કોસાડ) તૈયાર કરવા અંગે દરખાસ્ત સાથે સામેલ નકશામાં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવેલ વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૮૬ (કોસાડ) બનાવવા ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવાનું, ઈરાદો જાહેર કરવા અંગે સામેલ અધિસુચન મંજૂર કરવાનું તથા સદર અધિસુચન બહોળો ફેલાવો ધરાવતા બે સ્થાનિક દૈનિકપત્રોમાં એક-એક વખત પ્રસિધ્ધ કરવાનું તથા ઈરાદો જાહેર કર્યા મુજબ તેને સરકારશ્રીનાં રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવા તેમજ મુસદ્દો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૦/૨૦૨૨ સર્વાનુમતે મંજૂર

